

*This Question Paper contains 12 printed pages.
(Sections - A, B, C & D)*

Sl.No. 1744

11 (G)

(MAY, 2021)
(New Course)

Time : 3 Hours]

[Maximum Marks : 80]

સૂચનાઓ :

- સ્પષ્ટ વંચાય તેવું હસ્તલેખન જળવવું.
 - આ પ્રક્રિપ્તમાં ચાર વિભાગ A, B, C અને D તથા 1 થી 53 પ્રશ્નો છે.
 - બધા ૭ પ્રશ્નો ફરજિયાત છે. આંતરિક વિકલ્પો આપેલા છે.
 - પ્રક્રિની જમણી બાજુના અંક તેના ગુણ દર્શાવે છે.
 - સૂચના પ્રમાણે આકૃતિઓ સ્વચ્છ, સ્પષ્ટ અને પ્રમાણસર દોરવી.
 - નવો વિભાગ નવા પાના પર લખવો. પ્રશ્નોના જવાબ કહમાં લખવા.

विभूग - A

- 3) સ્વયંપોષી પોષણ માટે આવશ્યક છે. [1]
- કાર્બન ડાયોક્સાઈડ
 - ક્લોરોફિલ
 - સૂર્યપ્રકાશ
 - ઉપરોક્ત તમામ
- 4) નીચે આપેલ પૈકી ક્યો સમૂહ માત્ર જૈવ-વિઘટનીય પદાર્�ો છે? [1]
- ધાસ, પુષ્પો, ચામડું
 - ધાસ, લાકડું અને પ્લાસ્ટિક
 - ફળોની છાલ, કેક, લીંબુનો રસ
 - કેક, લાકડું, ધાસ
- (i) અને (ii)
 - (i), (ii) અને (iv)
 - (i), (iii) અને (iv)
 - (ii) અને (iv)
- 5) બલ્લિંગોળ લેન્સ વડે કેવું પ્રતિબિંભ મેળવી શકતું નથી. [1]
- આભાસી અને નાનું
 - આભાસી અને મોટું
 - વાસ્તવિક અને નાનું
 - વાસ્તવિક અને મોટું
- 6) મેધ ધનુષ્ય બનવા માટે કઈ ઘટના / ઘટનાઓ સામેલ છે? [1]
- વધીભવન
 - વિભાજન
 - આંતરિક પરાવર્તન
 - આપેલ તમામ

■ નીચે આપેલા વિધાનો સાચાં બને તે રીતે ખાતી જગ્યા પૂરો. (પ્રશ્ન 7 થી 12)

- 7) કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ સાથે સહ સંયોજક બંધ બનાવવાની અદ્ધૃતીય ક્ષમતા ધરાવે છે. કાર્બનના આ ગુણધર્મને કહે છે. [1]

(કેટેનેશન, ચતુઃસંયોજકતા, ત્રિ સંયોજકતા)

- 8) તત્વોના વર્ગીકરણ માટે ત્રિપુટીનો નિયમ વૈજ્ઞાનિકે આપ્યો છે. [1]

(ન્યૂલેન્ડ, ડોબરેનર, મેન્ટેલીક)

- 9) પર્શરંધ્ર ખૂલવા-બંધ થવાની કિયાનું નિયમન કોષો કરે છે. [1]

(રક્ષક કોષો, અધિસ્તર કોષો, વાયુતક કોષો)

- 10) ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવનું નિર્માણ અંગ કરે છે. [1]

(શુક્રવાહિની, શુક્રપિંડ, અંડપિંડ)

- 11) કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિંગોળ લેન્સનો પાવર સૌથી વધારે છે. [1]

(20 સેમી, 30 સેમી, 10 સેમી)

- 12) સોલર સેલમાં આશરે W જેટલો વિદ્યુતપાવર ઉત્પન્ન થાય છે. [1]

(7.0, 0.7, 1.0)

■ નીચે આપેલા વિધાનો સાચાં છે કે ખોટાં તે જગ્યાવો. (પ્રશ્ન 13 થી 16)

13) મેન્ડેલીક્સ ગેલિયમનું નામ એકા-સિલિકોન આપ્યું હતું. [1]

14) મેન્ડેલના પ્રયોગમાં F_2 પેઢીમાં $\frac{1}{4}$ સંતતિ નીચા છોડની હતી. [1]

15) કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વકીભવનાંક 1 થી વધુ હોય છે. [1]

16) સૌર રૂક્કર “સૂર્ય ઉજાનું પ્રકાશ ઉજામાં રૂપાંતર” સિદ્ધાંત પર કાર્ય કરે છે. [1]

■ નીચે આપેલા પ્રશ્નોના માઝ્યાં મુજબ જવાબ આપો. (પ્રશ્ન 17 થી 24)

17) લંબમજજા દ્વારા કઈ કિયાઓનું નિયમન થાય છે? [1]

18) જંગલી કોબીજના પુષ્પોની વૃદ્ધિ અવરોધી કઈ વનસ્પતિ વિક્ષાવવામાં આવી છે? [1]

19) નર્મદાની ખીણમાંથી થોડા વર્ષો પૂર્વે કોના અશ્મી પ્રાસ થયા હતા? [1]

20) KWh એ કઈ ભૌતિક રાશિનો એકમ છે? [1]

21) ન્યુક્લિયર પાવર જનરેટરનો સૌથી મોટો ખતરો ક્યો છે? [1]

22) ટ્રેનોમાં વપરાતા પ્લાસ્ટીકના નિર્વતનીય કપ (ડિસ્પોઝેબલ કપ) નો ઉપયોગ ટાળવો / બંધ કરવો જોઈએ કારણ કે [1]

23) જોડકાં જોડો :

[1]

ઉર્જા સ્ત્રોત	પ્રકાર
a) ખનીજ તેલ	i) પુનઃ ગ્રાસ્ય
b) સમુદ્ર તાપીય ઉર્જા	ii) પરમાણુ ઉર્જા
	iii) પુનઃ અગ્રાસ્ય ઉર્જા

24) ખોટી જોડ શોધો.

[1]

- | | |
|-----------------|-------------------------------------|
| i) આયોડીન | - થાઈરોઇડ ગ્રાંથિ |
| ii) ઈન્સ્યુલિન | - ઇધિરની શર્કરાનું નિયમન |
| iii) પિટ્યૂટ્રી | - સંતુલિત વૃદ્ધિ માટે જરૂરી સ્ત્રાવ |
| iv) અંડપિડ | - ચયાપચયની કિયાનું નિયમન |

વિભાગ - B

■ પ્રક્રિયા ફ્રે 25 થી 36 પેકી કોઈપણ 9 પ્રક્રિયા 40 થી 50 શબ્દોની મર્યાદામાં માઝ્યા મુજબ ઉત્તર લખો
(દરેક પ્રક્રિયા 2 ગુણ રહેશે)

[18]

25) સાંદ્ર એસિડને મંદ કરતી વખતે શા માટે એસિડને પાણીમાં ઉમેરવામાં આવે છે?

[2]

26) એવી ઘાતુના ઉદાહરણ આપો.

[2]

- i) જે ઓરડાના તાપમાને પ્રવાહી હોય.
- ii) જે છરી વેદે આસાનીથી કાપી શકાય.
- iii) જે ઉચ્ચાની ઉત્તમ વાહક છે.
- iv) જે ઉચ્ચાની મંદ વાહક છે.

27) મેન્ટેલીફ આર્વત કોષ્ટક અને આધુનિક આર્વત કોષ્ટકના તફાવત બે-બે મુદ્દા લખો.

[2]

28) તત્વ X નો પરમાણુ કમાંક 12 છે.

[2]

i) તત્વ X ઓળખો અને તેની ઈલેક્ટ્રોન રચના લખો.

ii) તત્વ X ક્યા આર્વત અને ક્યા સમૂહમાં આવેલ છે તે જણાવો.

29) DNA પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે?

[2]

30) મનુષ્યમાં લિંગ - નિશ્ચયનની ઘટના સમજાવો.

[2]

31) બે બિંદુઓ વચ્ચે વિધુત સ્થિતિમાનનો તફાવત 1V છે. તેનો અર્થ શું થાય? વાહુકના બે છેડા વચ્ચે વિધુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવા મદદ કરતાં ઉપકરણનું નામ આપો.

[2]

32) ઓહમનો નિભય લખી તેનું સૂત્ર તારવો.

[2]

33) ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા જણાવો.

[2]

34) “સ્વચ્છ ભારત અભિયાન” અંતર્ગત કચરાના નિકાલની સમસ્યા ઓછી કરવા તમે શું યોગદાન આપી શકો?

[2]

35) જંગલોની અગત્ય જણાવો.

[2]

36) પર્યાવરણને બચાવવા માટેના બે - R.

[2]

i) Refuse (ના પાડવું)

ii) Reduce (ઓછો ઉપયોગ કરવો) સમજાવો.

વિભાગ - C

■ પ્રક્રિયા ક્રમ 37 થી 45 પૈકી કોઈપણ 6 પ્રક્રિયાના 60 થી 80 શબ્દોની મર્યાદામાં ટૂંકમાં માળ્યા મુજબ
ઉત્તર લખો. (દરેક પ્રક્રિયાના 3 ગુણ રહેશે) [18]

37) વિધટન પ્રક્રિયાના પ્રકાર જણાવી કોઈપણ બે પ્રક્રિયાના એક-એક ઉદાહરણ સમીકરણ સાથે લખો. [3]

38) એક ઝવેરી 22 કેરેટ સોનાના દાળીના બનાવે છે અને તેના ગ્રાહકો પાસેથી 22 કેરેટ સોનાનો ભાવ વસુલે
છે. તેનો વ્યવસ્થાય આ વ્યવહારને લીધે વધે છે. [3]

i) આપણે શા માટે 24 કેરેટ સોનાના દાળીના બનાવી શકતા નથી?

ii) સોનાના દાળીનાની બનાવટમાં ઉમેરી શકાય તેવી બે ઘાતુના નામ જણાવો.

iii) ઝવેરીની આ વર્તાણૂકમાં તેનો કયો ગુણ જોવા મળે છે?

39) સંયોજન X અને એટ્યુભિનિયમનો ઉપયોગ રેલ્વેના પાટાઓને જોડવા માટે થાય છે. [3]

i) સંયોજન X ઓળખો.

ii) આ પ્રક્રિયા કયા નામથી ઓળખાય છે?


iii) આ પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો.

40) લડવાની કે દોડવાની સ્થિતિમાં કયો અંત: સ્ત્રાવ સ્ત્રવે છે? પ્રાણી શરીરમાં થતી તેની અસરો જણાવો. [3]

41) ગર્ભનિરોધનની વિવિધ પદ્ધતિઓ વર્ણવો. [3]

42)

[3]



આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો.

- A ને ઓળખો અને તેનું કાર્ય જણાવો.
- B ને ઓળખો અને ફ્લન પછી તેમાં શું ફેરફાર થાય છે તે જણાવો.
- C ને ઓળખો અને ફ્લન પછી તેમાં શું ફેરફાર થાય છે તે જણાવો.

43) એક વિદ્યાર્થી સૂર્યપ્રકાશમાં લેન્સનો ઉપયોગ કરી કાગળ સળગાવે છે. [3]

- વિદ્યાર્થીએ ઉપયોગમાં લીધેલા લેન્સનો પ્રકાર જણાવો.
- આ ઘટનામાં મળતા પ્રતિબિંબનું સ્થાન જણાવો.
- આ ઘટનાની કિરણાકૃતિ દોરો.

44) પ્રકાશનું વક્તીભવન એટલે શું? પ્રકાશના વક્તીભવનના નિયમો લખો. [3]

45) અવરોધો R_1 અને R_2 , વોલ્ટમીટર, એમિટર, કળ, બેટરી અને વાહકતાર લઈ અવરોધોના સમાંતર જોડાણ માટેનો પરિપથ દોરો. અને અવરોધોના સમાંતર જોડાણ માટેના સમતુલ્ય અવરોધનું સૂત્ર લખો. [3]

વિભાગ - D

■ પ્રશ્ન ક્રમ 46 થી 53 પેકી કોઈપણ 5 પ્રશ્નોના 90 થી 120 શર્ષદોની મર્યાદામાં વિગતવાર માઝ્યા મુજબ ઉત્તર લખો. (દરેક પ્રશ્નના 4 ગુણ રહેશે) [20]

46) સોડીયમ કાર્બોનેટની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિ સહ વર્ણન કરો. [4]

47) માનવના પાચનતંત્રમાં pH અને મધમાખીના ડંખના ઉપચારમાં pH નું મહત્વ સમજાવો. [4]

48) સાખુ અને પ્રક્ષાલક (ડીટર્જન્ટ) માં રહેતા કિચારીલ આધુનિક સમૂહ જણાવી સાખુની સફાઈ કિચાની કિયાવિધિ સમજાવો. [4]

49) મૂત્રપિંડનિકાની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી મનુષ્યમાં મૂત્રનિર્માણની કિયા સમજાવો. [4]

50) મનુષ્યના પાચનતંત્રની નામનિર્દેશનવાળી આકૃતિ દોરી નાના-આંતરડામાં થતી પાચન કિયા વર્ણાવો. [4]


51) કાચના પ્રિઝમ વડે શૈત પ્રકાશનનું વિભાજન આકૃતિ દોરી સમજાવો. [4]

52) નીચેના પછો સમજાવો. [4]

- ઓવરલોડિંગ
- શોર્ટ સર્કિટ
- ફ્યુઝ
- અર્થિંગ

53)

[4]



આકृतिमાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકીય ક્ષેત્રમાં ભૂલા વિદ્યુતપ્રવાહ ધારિત વાહક સળિયા AB ના સ્થાનાંતરમાં નીચેના કિસ્સામાં શું અસર થશે?

- i) સળિયા AB માંથી પતાર થતો પ્રવાહ વધે.
- ii) વધુ પ્રબળ નાળયુંબળનો ઉપયોગ કરવામાં આવે.
- iii) સળિયા AB ની લંબાઈમાં વધારો કરવામાં આવે.
- iv) સળિયા AB નું સ્થાનાંતર મહત્તમ ક્યારે થશે?

